

# અગ્નિ સુરક્ષા માટે દરેકનું યોગદાન જરૂરી છે.

તમારા મકાનની બહારની બાજુ પર જ્વલનશીલ આવરણ દેખાય, તો તેનો મતલબ એ નથી કે તમારું મકાન અસુરક્ષિત છે. પણ, એક વાર આગ લાગી જાય, પછી આ જ્વલનશીલ આવરણ આગને ફેલાવવામાં મદદ કરી શકે છે.

આગનું જોખમ ઘટાડવા માટે અને પોતાને તથા તમારા પડોશીઓને અને તમારા પરિવારને સુરક્ષિત રાખવા માટે આવા કેટલાક સરળ પગલાં, છે, જે તમે અનુસરી શકો છો. કટોકટીની સ્થિતિ સર્જે ત્યારે 000 (ત્રણ વાર શૂન્ય) ને કોલ કરો.



બાલ્કનીમાં ધૂમ્રપાન ના કરો



બાલ્કનીમાં બાર્બેક્યુનો ઉપયોગ ના કરો



બાલ્કનીમાં ગેસ બોટલોનો સંગ્રહ ના કરો



ખાતરી કરો કે સ્મોક અલાર્મ ઢંકાયેલા કે ડિસ્કનેક્ટેડ નથી. દર મહિને તેનું પરીક્ષણ કરો. નવ-વોલ્ટ બેટરીઓ દર વર્ષે બદલો. 10-વર્ષની લિથિયમ બેટરીવાળા સ્મોક અલાર્મ મૂકવાનું વિચારો.



બાલ્કનીઓ, હોલવેઝ અને ઇવેક્યુએશન માર્ગોને વ્યવસ્થિત અને કચરાથી મુક્ત રાખો. તમારી પાસે કોઈ એવેક્યુએશન પ્લાન હોવો જરૂરી છે.



કપડાં અને અન્ય સામગ્રી એરકંડિશનિંગ એકમોથી ઓછામાં ઓછા એક મીટરના અંતરે રાખો.